


ज्जलंङ
दु सडुीङ



वुशुवनी डुरथड
आंङुनी डुडुड
गुङरुतुी

SIZE: 15(w) X 20(h) cms


મૂક લોકોના વિચારોની ગૂંજ સૌથી ઊંચી હોય છે
સ્ટીવન હોકિંગ

બ્લિંક ટુ સ્પીક દુનિયાની પહેલી આંખોની ભાષા છે. આ ભાષા એવાં લોકો માટે તૈયાર કરવામાં આવી છે જેમને બોલવામાં તકલીફ પડે છે. આ ભાષા એ લ સ / મ ન ડી (એમ્બ્યોટ્રોફિક લેટરલ સ્કલેરોસિસ/ મોટર ન્યૂરોન ડિસીઝ), કરોડરજજીની ઈજા (ક્વાડ્રિપ્લેજીયા – ડોકની નીચેનો લકવો), સેરેબ્રલ પાલ્સી, માથાની ઈજા, સ્ટ્રોક, સેરેબેલર અટેક્સિયા, મલ્ટિપલ સ્કલેરોસિસ, પાર્કિન્સન્સ ડિસીઝ અને અન્ય કોઈ ન્યૂરો-ડિજનરેટિવ વિકાર ધરાવતા દરદીઓ માટે સહાયક છે. સજગ મસ્તિષ્ક વાળા મેકેનિકલ વેન્ટિલેટર પર રાખેલા દરદી પણ આનો ઉપયોગ કરી શકે છે. આઈસીયુ (ઈન્ટેન્સિવ કેર યુનિટ) માં રાખેલા દરદીઓ અથવા બાય-પૉપ, સી-પૉપ અથવા હોમ વેન્ટિલેટર પર રાખેલા દરદી પણ આ ભાષાનો ઉપયોગ કરી શકે છે. આ ભાષા દરદીઓ તથા સંભાળ લેનાર લોકો માટે તેમ જ પરિવારના સદસ્યો વચ્ચે વાતચીત સરળ બનાવે છે. આ ભાષા વાતચીત કરવા સ્થાયી અથવા અસ્થાયી ઉપાય બની શકે છે.

બ્લિંક ટુ સ્પીક ટ્રેનર સાથે સમય નક્કી કરવા કૃપા કરી આશા એક હોપ ફાઉન્ડેશનની સંસ્થાપક અધ્યક્ષ અને ન્યૂરોજેન બ્રેન ઍન્ડ સ્પાઈન ઈન્સ્ટિટ્યુટના ડેપ્યુટી ડાયરેક્ટર હેમાંગી સાનેનો સંપર્ક કરો ગીત રાઠી, સ્વયંસેવક, આશા એક હોપ ફાઉન્ડેશન અને બ્લિંક ટુ સ્પીક, સ્થાપક.

લક્ષ્મી નરેનને ખાસ આભાર

ज्जिंङ
दु स्पीङ



विश्वनी प्रथम
आंभोनी भाषा
गुजराती

બ્લિંક ટુ સ્પીકનો ઉપયોગ કરતી વખતે
આ બાબતોનું ધ્યાન રાખો

1. આંખોની ભાષામાં મુખ્ય આઠ વ્યંજન છે.
2. સૌથી સામાન્ય સંદેશ માટે આંખોની ગતિવિધિઓના વિભિન્ન મિશ્રણોનો ઉપયોગ કરાય છે.
3. આંખોની બે ગતિવિધિઓ વચ્ચે હંમેશા પર્યાપ્ત અંતરાળ રાખવાનું હંમેશા યાદ રાખો.
4. સંદેશને સ્પષ્ટ સમજાવવા માટે દરેક સંકેતને ફરી ફરી કહી શકાય છે.
5. પહેલા મહિને પહેલા 15 સંકેતો સાથે શરૂઆત કરો. ધીમે ધીમે દર મહિને 25 નવા સંકેતો સાથે તમારી શબ્દાવલિ વધારતા રહો.
6. પુસ્તકના છેલ્લા પાને મૂળાક્ષર પાનું છે. તમે આ સિસ્ટમનો ઉપયોગ ફાળવેલ ચિન્હોમાં ન હોય એવાં શબ્દો જણાવવા માટે કરી શકો છો.
7. તમારા માટે છ અતિરિક્ત સંકેત છે. તમારા પ્રિયજનો માટે ખાનગી સંદેશ નિર્ધારિત કરવા માટે આનો ઉપયોગ કરો.

આંખોની ભાષા

આંખ બંધ કરો



પલક ઝપકાવો




જમણી બાજુ જુઓ



ડાબી બાજુ જુઓ



ઉપર જુઓ



નીચે જુઓ



એક આંખ પલકારો



આંખો ફેરવો




લાંબા સમય સુધી આંખો બંધ રાખો




આરંભ/
અંત

વારંવાર આંખો ઝપકાવો




ખોટું

1 વાર પલક ઝપકાવો



૬૧


2 વાર પલક ઝપકાવો



x 2




૦૧

3 વાર પલક ઝપકાવો




હું ઠીક છું

1 વાર જમણી બાજુ જુઓ
1 વાર ડાબી બાજુ જુઓ
1 વાર પલક ઝપકાવો




હું ઠીક નથી

1 વાર પલક ઝપકાવો
1 વાર જમણી બાજુ જુઓ




પરિવારને બોલાવો
(દીકરો/દીકરી/પતિ/પત્ની/મા/પિતા)

1 વાર પલક ઝપકાવો
1 બાર ડાબી બાજુ જુઓ




ડૉક્ટરને બોલાવો

4 વાર પલક ઝપકાવો





મને ઊંઘ આવે છે

જમણી બાજુ જુઓ




શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે

1 વાર જમણી બાજુ જુઓ
1 વાર ડાબી બાજુ જુઓ




પાણી

1 વાર ઉપર જુઓ






શૌચાલય

1 વાર પલક ઝપકાવો
1 વાર ઉપર જુઓ




હૃદયમાં દુખાવો

2 વાર પલક ઝપકાવો
1 વાર જમણી બાજુ જુઓ
2 વાર પલક ઝપકાવો



આજે તમે કેમ છો ?

વારંવાર એક આંખ ઝપકાવો



આપાતકાલ

દરેક વિકલ્પ પર ઈશારો કરો અને પ્રતિક્રિયા માટે રાહ જુઓ



ચક્કર આવી
રહ્યા છે



નાક બંધ છે



મરોડ (મોચ)



ગભરાટ થાય છે



ગળામાં કંઈક
અટક્યું છે

હા = 1 વાર પલક ઝપકાવો


ના = 2 વાર પલક ઝપકાવો

લાંબા સમય સુધી આંખો બંધ રાખો
વારંવાર આંખ ઝપકાવો

A



B



સંકટ

દરેક વિકલ્પ પર ઈશારો કરો અને પ્રતિક્રિયા માટે રાહ જુઓ



કોઈ હેરાન કરે છે



ચૌન શોષણ



ચોર



પોલીસને બોલાવો

હા = 1 વાર પલક ઝપકાવો

ના = 2 વાર પલક ઝપકાવો

2 વાર એક આંખ ઝપકાવો



સમસ્તયા

દરેક વિકલ્પ પર ઈશારો કરો અને પ્રતિક્રિયા માટે રાહ જુઓ



ઠંડી લાગે છે



મારે થૂંકવું છે



ગરમી લાગે છે



કોળિયો દાંતમાં
અટકી ગયો છે




માથું દુખે છે

હા = 1 વાર પલક ઝપકાવો

ના = 2 વાર પલક ઝપકાવો

2 વાર એક આંખ ઝપકાવો
1 વાર આંખ ફેરવો



મારું સ્થાન બદલો

દરેક વિકલ્પ પર ઈશારો કરો
અને પ્રતિક્રિયા માટે રાહ જુઓ



ખુરસી



પલંગ



સોફા



વ્હીલચેર



ડાઈનિંગ ટેબલ

હા = 1 વાર પલક ઝપકાવો


ના = 2 વાર પલક ઝપકાવો

3 વાર એક આંખ ઝપકાવો






હું તને પ્રેમ કરું છું

1 વાર ઉપર જુઓ
1 વાર એક આંખ ઝપકાવો






મને માફ કરી દો

1 વાર ડાબી આંખ ઝપકાવો
1 વાર જમણી આંખ ઝપકાવો
2 વાર પલક ઝપકાવો




ધન્યવાદ

1 વાર ઉપર જુઓ
1 વાર નીચે જુઓ
2 વાર પલક ઝપકાવો




મને ગળે મળો

1 વાર એક આંખ ઝપકાવો




કંઈક વાત કરીએ

1 વાર પલક ઝપકાવો
1 વાર ઉપર જુઓ
1 વાર એક આંખ ઝપકાવો




ચાલો બહાર જઈએ

1 વાર ડાબી બાજુ જુઓ
1 વાર જમણી બાજુ જુઓ
1 વાર આંખ ઝપકાવો




મારે ઘરે જવું છે

1 વાર જમણી બાજુ જુઓ
1 વાર આંખ ફેરવો



મને મારા કુતરા
/ બિલાડીને મળવું છે

2 વાર પલક ઝપકાવો
1 વાર આંખ ફેરવો
2 વાર પલક ઝપકાવો




અભિનંદન

2 વાર પલક ઝપકાવો
લાંબા સમય સુધી આંખો બંધ રાખો




મને તમારા પર ગર્વ છે

1 વાર એક આંખ ઝપકાવો
1 વાર પલક ઝપકાવો




મને દુખાવો / બેચેની છે

દરેક ભાગ તરફ ઈશારો કરો
અને પ્રતિક્રિયા માટે રાહ જુઓ



આગળ




પાછળ

હા = 1 વાર પલક ઝપકાવો

ના = 2 વાર પલક ઝપકાવો

1 વાર આંખ ફેરવો
1 વાર એક આંખ ઝપકાવો



મારી પોઝિશન બદલો

દરેક વિકલ્પ પર ઈશારો કરો અને પ્રતિક્રિયા માટે રાહ જુઓ



ખુરસી પર બેસાડો



સીધા સુવડાવો



જમણી તરફ ફેરવો



ડાબી તરફ ફેરવો

હા = 1 વાર પલક ઝપકાવો

ના = 2 વાર પલક ઝપકાવો

1 વાર ઉપર જુઓ
1 વાર નીચે જુઓ

A



B



મને કંઈક ખાવાનું મળ છે

દરેક વિકલ્પ પર ઈશારો કરો અને પ્રતિક્રિયા માટે રાહ જુઓ



ફળ



મનગમતું ખાવાનું



ઠંડું



ગરમ



તીખું




ગરમ

હા = 1 વાર પલક ઝપકાવો

ના = 2 વાર પલક ઝપકાવો

1 વાર આંખ ફેરવો



મનોરંજન

દરેક વિકલ્પ પર ઈશારો કરો અને પ્રતિક્રિયા માટે રાહ જુઓ



ટીવી



સંગીત



છાપું



આઈપેડ




ફિલ્મ

હા = 1 વાર પલક ઝપકાવો

ના = 2 વાર પલક ઝપકાવો

1 વાર આંખ ફેરવો
1 વાર પલક ઝપકાવો



વિદ્યુત ઉપકરણ

દરેક પિક્ચર પર ઈશારો કરો
અને પ્રતિક્રિયા માટે રાહ જુઓ



પંખો



એસી



લાઈટ



ટીવી



હીટર



વધારો





ઓછું કરો

હા = 1 વાર પલક ઝપકાવો


ના = 2 વાર પલક ઝપકાવો

2 વાર જમણી આંખ ઝપકાવો
2 વાર ડાબી આંખ ઝપકાવો




કપડાંથી લૂંછો

દરેક ભાગ તરફ ઈશારો કરો
અને પ્રતિક્રિયા માટે રાહ જુઓ



આગળ



પાછળ



ચહેરો

હા = 1 વાર પલક ઝપકાવો


ના = 2 વાર પલક ઝપકાવો

ડાબી બાજુ જુઓ




મને હલાવો

દરેક ભાગ તરફ ઈશારો કરો
અને પ્રતિક્રિયા માટે રાહ જુઓ



આગળ





પાછળ

હા = 1 વાર પલક ઝપકાવો


ના = 2 વાર પલક ઝપકાવો

1 વાર એક આંખ ઝપકાવો
2 વાર પલક ઝપકાવો




માલિશ કરો

દરેક ભાગ તરફ ઈશારો કરો
અને પ્રતિક્રિયા માટે રાહ જુઓ



આગળ




પાછળ

હા = 1 વાર પલક ઝપકાવો


ના = 2 વાર પલક ઝપકાવો

1 વાર પલક ઝપકાવો
1 વાર આંખ ફેરવો
1 વાર એક આંખ ઝપકાવો




મને પકડો

દરેક ભાગ તરફ ઈશારો કરો
અને પ્રતિક્રિયા માટે રાહ જુઓ



આગળ




પાછળ

હા = 1 વાર પલક ઝપકાવો


ના = 2 વાર પલક ઝપકાવો

2 વાર પલક ઝપકાવો
1 વાર ઉપર જુઓ




ઉંચકો

દરેક ભાગ તરફ ઈશારો કરો
અને પ્રતિક્રિયા માટે રાહ જુઓ



આગળ




પાછળ

હા = 1 વાર પલક ઝપકાવો


ના = 2 વાર પલક ઝપકાવો

1 વાર જમણી આંખ ઝપકાવો
1 વાર પલક ઝપકાવો
1 વાર ડાબી આંખ ઝપકાવો




પાણીથી સાફ કરો

દરેક ભાગ તરફ ઈશારો કરો
અને પ્રતિક્રિયા માટે રાહ જુઓ



આગળ




પાછળ

હા = 1 વાર પલક ઝપકાવો


ના = 2 વાર પલક ઝપકાવો

2 વાર ડાબી આંખ ઝપકાવો
2 વાર જમણી આંખ ઝપકાવો




ખંજવાળો

દરેક ભાગ તરફ ઈશારો કરો
અને પ્રતિક્રિયા માટે રાહ જુઓ



આગળ





પાછળ

હા = 1 વાર પલક ઝપકાવો

ના = 2 વાર પલક ઝપકાવો

2 વાર એક આંખ ઝપકાવો
1 વાર પલક ઝપકાવો



બદલો

દરેક વિકલ્પ પર ઈશારો કરો
અને પ્રતિક્રિયા માટે રાહ જુઓ



કપડાં



તકિયા/
તકિયાનું કવર



ડાયપર





ચાદર/
રજાઈ

હા = 1 વાર પલક ઝપકાવો

ના = 2 વાર પલક ઝપકાવો

2 વાર એક આંખ ઝપકાવો
2 વાર પલક ઝપકાવો



બરાબર કરો

દરેક વિકલ્પ પર ઈશારો કરો
અને પ્રતિક્રિયા માટે રાહ જુઓ



રજાઈ



કપડાં



ચશ્મા



વાળ




તકિયા

હા = 1 વાર પલક ઝપકાવો


ના = 2 વાર પલક ઝપકાવો

1 વાર ઉપર જુઓ
1 વાર નીચે જુઓ
1 વાર એક આંખ ઝપકાવો




જન્મદિવસ/ વર્ષગાંઠ/ તહેવાર/
મદર્સ ડે ની શુભેચ્છા




1 વાર ઉપર જુઓ
1 વાર નીચે જુઓ
2 વાર એક આંખ ઝપકાવો




1 વાર આંખ ફેરવો
1 વાર પલક ઝપકાવો
1 વાર આંખ ફેરવો
1 વાર એક આંખ ઝપકાવો




1 વાર જમણી બાજુ જુઓ
2 વાર પલક ઝપકાવો
1 વાર ડાબી બાજુ જુઓ






1 વાર જમણી બાજુ જુઓ
1 વાર ડાબી બાજુ જુઓ
3 વાર પલક ઝપકાવો




1 વાર જમણી આંખ ઝપકાવો
2 વાર ડાબી આંખ ઝપકાવો



2 વાર જમણી આંખ ઝપકાવો
1 વાર પલક ઝપકાવો
2 વાર ડાબી આંખ ઝપકાવો



1 વાર આંખ ઝપકાવો
1 વાર આંખ ફેરવો
1 વાર પલક ઝપકાવો



વર્ણમાળા

A

1 વાર ઝપકાવવી

B

1 વાર ઝપકાવવી
1 વાર આંખ મારવી

C

1 વાર બંધ કરવી
1 વાર ઉપર

D

1 વાર ઝપકાવવી
1 વાર ફેરવવી

E

1 વાર ઝપકાવવી
1 વાર ડાબી બાજુ

F

1 વાર ઝપકાવવી
1 વાર જમણી બાજુ

G

1 વાર ઝપકાવવી
1 વાર ઝપકાવવી

H

1 વાર આંખ મારવી

I

1 વાર આંખ મારવી
1 વાર ઉપર

J

1 વાર આંખ મારવી
1 વાર ફેરવવી

K

1 વાર આંખ મારવી
1 વાર ડાબીબાજુ

L

1 વાર આંખ મારવી
એક વાર જમણી બાજુ

M

1 વાર આંખ મારવી
1 વાર આંખ મારવી

N

1 વાર આંખ મારવી
2 વાર આંખ મારવી

O

1 વાર ફેરવવી

P

1 વાર ફેરવવી
1 વાર ફેરવવી

Q

1 વાર ઉપર

R

1 વાર ઉપર
1 વાર નીચે

S

1 વાર ઉપર
1 વાર ડાબી બાજુ

T

1 વાર ઉપર
1 વાર જમણી બાજુ

U

1 વાર ઉપર
1 વાર ઉપર

V

1 વાર જમણી બાજુ

W

1 વાર જમણી બાજુ
1 વાર ડાબી બાજુ

X

1 વાર જમણી બાજુ
1 વાર જમણી બાજુ

Y

1 વાર ડાબી બાજુ

Z

1 વાર ડાબી બાજુ ઝપકવી
1 વાર જમણી બાજુ ઝપકવી

અનુક્રમણિકા

આરંભ/અંત	8	મને ગળે ભેટો	33
ખોટું	9	થોડીક વાત કરીએ	34
હા	10	ચાલો બહાર જઈએ	35
ના	11	મારે ઘરે જવું છે	36
હું ઠીક છું	12	મારે મારા કુતરા/બિલાડીને મળવું છે	37
હું ઠીક નથી	13	બધાઈ હો (અભિનંદન)	38
પરિવારને બોલાવો	14	મને તમારા પર ગર્વ છે	39
ડૉક્ટરને બોલાવો	15	મને દુખાવો/બેચેની છે	40
મને ઊંઘ આવે છે	16	આગળ/પાછળ	41
સ્વાસ લેવામાં તકલીફ થાય છે	17	મારી પોઝિશન બદલો	42
પાણી	18	ખુસ્સી પર બેસાડો/સીધો સૂવડાવો/ જમણી બાજુ ફેરવો/ડાબી બાજુ ફેરવો	43
શૌચાલય	19	મને કંઈક ખાવાનું મન છે	44
હૃદયમાં દુખાવો	20	ફળ/મનભાવતી વાનગી/હંડું/તીખું/ગરમ	45
તમે આજે કેમ છો?	21	મનોરંજન	46
આપાતકાલ	22	ટીવી/સંગીત/છાપું/આઈપેડ/ફિલ્મ	47
ચક્કર આવે છે/નાક બંધ/મોચ/ગભરાટ થાય છે/ ગળામાં કંઈક અટક્યું છે	23	વિદ્યુત ઉપકરણ	48
સંકટ	24	પંજો/એસી/લાઈટ/ટીવી/હીટર/વધારો/ઓછું કરો	49
કોઈ હેરાન કરે છે/ચૌન શોષણ/ચોર/ પોલીસને બોલાવો	25	કપડાંથી લૂંછો	50
સમસ્યા	26	આગળ/પાછળ/ચહેરો	51
હંડ લાગે છે/મારે થૂંકવું છે/ગરમી લાગે છે/ કોળિયો દાંતમાં અટકી ગયો છે/માથું દુખે છે	27	મને હલાવો	52
મારું સ્થાન બદલો	28	આગળ/પાછળ	53
ખુસ્સી/પલંગ/સોફા/વ્હીલચેર/ડાઈનિંગ ટેબલ	29	માલિશ કરો	54
હું તને પ્રેમ કરું છું	30	આગળ/પાછળ	55
મને માફ કરી દો	31	મને પકડો	56
ધન્યવાદ	32	આગળ/પાછળ	57
		ઉંચકો	58
		આગળ/પાછળ	59

અનુક્રમણિકા

પાણીથી સાફ કરો	60
આગળ/પાછળ	61
ખંજવાળો	62
આગળ/પાછળ	63
બદલો	64
કપડાં/તકિયા/તકિયાના કવર/ડાયપર/ ચાદર/રજાઈ	65
બરાબર કરો	66
રજાઈ/કપડાં/ચશ્મા/વાળ/તકિયા	67
જન્મ દિવસ/વર્ષગાંઠ/તહેવાર/મદર્સ ડે ની શુભેચ્છા	68
-----	69
-----	70
-----	71
-----	72
-----	73
-----	74
વર્ષમાળા	75

કૃપા કરી સંપર્ક કરો

ડૉ. હેમાંગી સાને

સંસ્થાપક, આશા એક હોપ ફાઉન્ડેશન
ડેપ્યુટી ડાયરેક્ટર, ન્યૂરોજેન બ્રેન ઍન્ડ સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ
402, ગુરુપ્રભા એપાર્ટમેન્ટ, સેનાપતિ બાપટ રોડ, દાદર (પશ્ચિમ),
મુંબઈ, મહારાષ્ટ્ર 400028

+91 98197 41333

ગીત રાઠી

સ્વયંસેવક, આશા એક હોપ ફાઉન્ડેશન અને બ્લિંક ટુ સ્પીક, સ્થાપક.
ડેપ્યુટી ડાયરેક્ટર, ન્યૂરોજેન બ્રેન ઍન્ડ સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ
402, ગુરુપ્રભા એપાર્ટમેન્ટ, સેનાપતિ બાપટ રોડ, દાદર (પશ્ચિમ),
મુંબઈ, મહારાષ્ટ્ર 400028

+91 9833890099

ડૉ. આલોક શર્મા

ડાયરેક્ટર, ન્યૂરોજેન બ્રેન ઍન્ડ સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ
પ્લોટ 19, સેક્ટર 40, સીવૂડ્સ ગ્રાંડ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પાસે,
ઑફ પામ બીચ રોડ, સીવૂડ્સ, નવી મુંબઈ, મહારાષ્ટ્ર 400028

+91 99202 00400



ashaekhope.com | neurogenbsi.com

blinktospeak.com
ashaekhope.com | neurogenbsi.com

SIZE: 15(w) X 20(h) cms

વિદ્યા સુ સ્પીક

શાળાઓ માટે - ગુજરાતી